



DCX-1901270201030502 Seat No. _____

B. A. (Sem. III) (CBCS) (W.E.F. 2019) Examination

August - 2022

Psychology : Paper-5 (Optional-1)

(Positive Psychology)

(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તરો આપો.

- 1 વિધાયક મનોવિજ્ઞાન અને અન્ય મનોવિજ્ઞાન સાથેનાં સંબંધ સમજાવો. 14
- 2 અસાધારણ વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ સમજાવો. 14
- 3 મનોવૈજ્ઞાનિક સુખાકારી વિશે વિસ્તૃત સમજૂતી આપો. 14
- 4 સંસ્કૃતિ અને ક્ષેમકુશળતાની વિગતવાર ચર્ચા કરો. 14
- 5 હકારાત્મક લાગણીઓ અને સુખાકારીની સમજૂતી આપો. 14
- 6 વિધાયક આવેગ એટલે શું ? વિધાયક આવેગો અને તંદુરસ્તીના સ્ત્રોતો વર્ણવો. 14
- 7 સમગ્ર જીવનમાં સુખ વિશે વિગતે સમજાવો. 14
- 8 અમેરિકન સુખની વ્યક્તિગત શૈલી સમજાવો. 14
- 9 ટૂંક નોંધ લખો : 14
(1) સ્વાસ્થ્યના પ્રાપ્તિસ્થાનો.
(2) એશિયન સુખની વ્યક્તિગત શૈલી
- 10 ટૂંક નોંધ લખો : 14
(1) સુખનો ખ્યાલ
(2) વિધાયક મનોભાવ અને વર્તન.

ENGLISH VERSION

- Instructions :** (1) The marks of all the questions are the same.
(2) Give the answers of any five questions.

- | | | |
|----|--|----|
| 1 | Explain the relations between positive psychology and other psychology. | 14 |
| 2 | Explain the characteristics of abnormal personality. | 14 |
| 3 | Explain in detail of psychological well-being. | 14 |
| 4 | Discuss in detail of culture and well-being. | 14 |
| 5 | Describe in detail of positive emotions and well-being. | 14 |
| 6 | What is positive emotion ? Explain the positive emotions and health resources. | 14 |
| 7 | Explain in detail happiness across the life span. | 14 |
| 8 | Explain the personal style of happiness in America. | 14 |
| 9 | Write short notes :
(1) Health Resources.
(2) Personal style of happiness in Asia. | 14 |
| 10 | Write short notes :
(1) Concept of Happiness.
(2) Positive mood and behavior. | 14 |